

પત્રકમાંક/જિરગઅ/રા.ખેમકું/૪૨૩૭ થી ૪૨૮૭ /૨૦૧૮

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી

કિષ્ના હોસ્પિટલ કંપાઉન્ડ હિંમતનગર

તા. ૧૫/૧૧/૨૦૧૮

પ્રતિ,

જિલ્લા રમત ગમત અધિકારી શ્રી

ગુજરાત રાજ્ય તમામ.

વિષય : ખેલ મહાકુંભ - ૨૦૧૮ અંતર્ગત યોજનાર રાજ્ય કક્ષા

ગિલી દંડા સ્પર્ધા કાર્યક્રમ બાબત

શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જાણાવવાનું કે ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા પ્રેરીત અને જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા આયોજીત ખેલ મહાકુંભ - ૨૦૧૮ અંતર્ગત યોજનાર રાજ્ય કક્ષા ગિલી દંડા તમામ વય ગ્રુપ ભાઈઓ બહેનો સ્પર્ધાનો વિગતે કાર્યક્રમ નીચે મુજબ છે.

કાર્યક્રમ સૂચી


સ્પર્ધા તારીખ	તા. ૦૨-૧૨-૨૦૧૮ થી તા. ૦૫-૧૨-૨૦૧૮
સ્પર્ધા સ્થળ	(૧) રમત સંકુલ, ભોલેશ્વર હિંમતનગર જી. સાબરકાંઠા
રીપોર્ટીંગ સ્થળ	રમત ગમત સંકુલ, ભોલેશ્વર હિંમતનગર જી. સાબરકાંઠા
સંપર્ક નંબર	શ્રી એસ એમ પટેલ- ૯૯૯૮૮૮૦૪૯૪
	શ્રીમતિ આશાબેન પટેલ (પ્રાંત યુવા વિકાસ અધિકારી સા.કાંઠા) - ૯૭૩૭૧૭૧૧૪૪
	શ્રીમતી બિજલબેન પટેલ(પ્રાંત યુવા વિકાસ અધિકારી) -૯૪૨૯૧૭૮૫૪૬

ક્રમ	વય ગ્રુપ	રીપોર્ટીંગ તારીખ / સમય	રીપોર્ટીંગ સ્થળ	સ્પર્ધા શરૂ થવા તારીખ અને સમય
૧	તમામ વયગ્રુપ (ભાઈઓ)	૦૨-૧૨-૨૦૧૮ સવારે ૮.૦૦ કલાક	રમત સંકુલ, ભોલેશ્વર હિંમતનગર	૦૨-૧૨-૨૦૧૮ સવારે ૧૧.૦૦ કલાક થી
૨	તમામ વયગ્રુપ (બહેનો)	૦૩-૧૨-૨૦૧૮ સવારે ૮.૦૦ કલાક	રમત સંકુલ, ભોલેશ્વર હિંમતનગર	૦૩-૧૨-૨૦૧૮ સવારે ૧૧.૦૦ કલાક થી

સ્પર્ધા અંગે જરૂરી સૂચના :-

(૧) સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવનાર ખેલાડીઓએ પોતાના વયગ્રુપ પ્રમાણે સ્પર્ધા તારીખે સવારે ૮.૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનો રહેશે. ફક્ત પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ટીમ ના ખેલાડીઓને પ્રવાસ ખર્ચ અત્રેથી આપવામાં આવશે. ફક્ત વિજેતા ટીમ ના ખેલાડીઓને નિવાસ વ્યવસ્થા અત્રેથી આપવામાં આવશે વિજેતા ટીમ ના ખેલાડીઓને સિવાયની ટીમને પ્રવાસ તથા નિવાસ વ્યવસ્થા ખેલાડીઓએ જાતે કરવાની રહેશે. (૨) નિવાસ અને સ્પર્ધા સ્થળે ઉપલબ્ધ મહત્તમ સગવડોનો ઉપયોગ કરવામાં આવશે. નિવાસ સ્થળે કોઈ પણ પ્રકારનું નુકશાન કરવામાં આવશે તો પ્રવાસ ખર્ચ ચુકવવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવી. (૪) પ્રવાસ ખર્ચ ટુંકા માં ટુંકા અંતરનું ભાગ પાડ્યા સિવાયનું સીધા રૂટનું અને સાદી/એક્સપ્રેસ/રેલ્વે બીજા વર્ગનું (રીઝર્વેશન ચાર્જ વગરનું) ભાડું ટીકીટ રજુ કરવાથી ચુકવવામાં આવશે. જેની જાણ કરશો (૫) ટીમનાતમામ ખેલાડીઓએ ઓનલાઇન KMK ID નંબર વાળી સ્લીપ સાથે આધારકાર્ડ તથા જન્મ તારીખના પુરાવા સાથે લાવવાના રહેશે. (૭) સ્પર્ધા/નિવાસ સ્થળે શિસ્તબધ્ધ રીતે વર્તવાનું રહેશે ગેર શિસ્ત આચરનાર ટીમ કે ખેલાડીને સ્પર્ધામાંથી બાકાત કરવામાં આવશે. (૮) સ્પર્ધા કાર્યક્રમ અનુસાર રીપોર્ટીંગ કરવાનું રહેશે. કોઈ ટીમ કે ખેલાડી દર્શાવેલ સમય, તારીખ પહેલાં આવશે તો તેઓની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. ખાસ નોંધ :- જે ટીમનું રીપોર્ટીંગ જે દિવસ માટે જણાવેલ હોય તે દિવસે જ આવવાનું રહેશે .જે ટીમ અગાઉથી આવશે તેમની કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહિ. વિજેતા થનારા ટીમે ફરજિયાત રોકાવાનું રહેશે તો એ પ્રમાણે ની વ્યવસ્થા કરીને નીકળવું આયોજક દ્વારા ફેરફાર ને અવકાશ રહેશે જે સર્વેને બંધનકર્તા રહેશે.

આપનો વિશ્વાસુ.



(ડૉ અશોક રાવલ)

જિલ્લા રમત ગમત અધિકારી

સાબરકાંઠા, હિંમતનગર

સવિનય નકલ રવાના જાણ સારૂ:

- ૧) સચિવશ્રી, રમત ગમત યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર
- ૨) ડાયરેક્ટર જનરલશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ,ગાંધીનગર
- ૩) કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર
- ૪) કલેક્ટરશ્રી, સાબરકાંઠા, હિંમતનગર
- ૫) સચિવ શ્રી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ,ગાંધીનગર
- ૬) પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા, હિંમતનગર
- ૭) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, સાબરકાંઠા, હિંમતનગર
- ૮) સિવિલ સર્જનશ્રી, સિવિલ હોસ્પિટલ, હિંમતનગર જરૂરી મેદાન સ્થળ પર મેડીકલ વ્યવસ્થા સારૂ.
- ૯) મદદનીશ કમિશનરશ્રી, આદિજાતિ વિકાસ, સાબરકાંઠા, હિંમતનગર જરૂરી નિવાસ વ્યવસ્થા સારૂ.
- ૧૦) નાયબ નિયામકશ્રી, અનુ. જાતિ કલ્યાણ, સાબરકાંઠા, હિંમતનગર જરૂરી નિવાસ વ્યવસ્થા સારૂ.
- ૧૧) સહાયક માહિતી નિયામકશ્રી. હિંમતનગર વિના મુલ્યે બહોળી પ્રસિધ્ધિ અર્થે
- ૧૨) ટીમ લીડર ખેલ મહાકુંભ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ,ગાંધીનગર
- ૧૩) સીનીયર કોચશ્રી તમામ, ગુજરાત રાજ્ય.
- ૧૪) સીનીયર કોચશ્રી, સાબરકાંઠા, હિંમતનગર મેદાનની વ્યવસ્થા સારૂ.
- ૧૫) સેક્રેટરીશ્રી, ગુજરાત સ્ટેટ ગિલી ઇંડા એસોસીએશન, ગુજરાત રાજ્ય